

**AJ-11009**

Seat No. _____

Second Year B. A. (Non CBCS) Examination**March / April – 2016****Economics : Paper - V***(Industrial Economics) (New Course)*

Time : 3 Hours]

[Total Marks : 100

સૂચના : (૧) આંતરિક વિકલ્પના આધારે બધા પ્રશ્નોના ઉત્તરો આપો.

(૨) બધા જ પ્રશ્નોના ગુણ સરખા છે.

- 1 ઔદ્યોગિક અર્થશાસ્ત્ર એટલે શું ? ઔદ્યોગિક અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર જણાવો. 20

અથવા

- 1 ભારતમાં ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો અર્થ આપી તેનું મહત્વ અને મર્યાદાઓ જણાવો. 20

- 2 આલ્ફ્રેડ વેબરે રજૂ કરેલા સ્થાનિયકરણનો સિદ્ધાંત સમજાવો. 20

અથવા

- 2 ઔદ્યોગિક શ્રમિકોની ખાસિયતો જણાવી તેની સમસ્યાઓ અને ઉકેલો ચર્ચો. 20

- 3 વિનિવેશનો અર્થ અને વર્તમાન વિનિવેશ નીતિ સવિસ્તર સમજાવો. 20

અથવા

- 3 ઔદ્યોગિક નાણાં પ્રબંધના વિવિધ સ્ત્રોતો સવિસ્તર સમજાવો. 20

- 4 વૈશ્વિકીકરણની ભારતના ઉદ્યોગો ઉપરની અસરો સવિસ્તર સમજાવો. 20

અથવા

- 4 વેતનનો અર્થ અને પ્રકારો જણાવી. વાસ્તવિક વેતનને અસર કરતાં પરિબળો સમજાવો. 20

- 5 ટૂંકનોંધ લખો : (ગમે તે બે) 20

(૧) ખાનગીકરણના પ્રશ્નો

(૨) ખાનગીકરણ અને જાહેરક્ષેત્ર વચ્ચેનો તફાવત

(૩) શ્રમ સંગઠનની મર્યાદાઓ

(૪) પેઢીનું ઇષ્ટકદ નક્કી કરતાં પરિબળો.

ENGLISH VERSION

Instructions :

- (1) Attempt all questions on the basis of internal option.
- (2) All questions carry equal marks.

- 1 What is meant by Industrial Economics ? Discuss nature and scope of Industrial Economics. **20**

OR

- 1 Explain the meaning of cottage and small scale industries in India and its importance and limitation. **20**

- 2 Explain the theory of location of Alfred Waber. **20**

OR

- 2 Discuss the characteristics and limitations and remedies of Industrial Labour. **20**

- 3 Explain the meaning of disinvestment and clarify present disinvestment policy. **20**

OR

- 3 Narrate the different sources of Industrial finance. **20**

- 4 Discuss in detail the impact of globalization on Indian industries. **20**

OR

- 4 Give the meaning and type of wages and explain the factors affecting to real wages. **20**

- 5 Write short notes : (any two) **20**

- (1) Problems of privatization
- (2) Difference between private sector and public sector
- (3) The limitations of labour union
- (4) Factor responsible for the optimum size of firm.